

## આક્રિમિક પાક આયોજન ખરીફ ૨૦૧૬

### ૧. પ્રસ્તાવના

રાજ્યમાં ચોમાસા દરમ્યાન વરસાદ સમયસર અને જરૂરીયાત મુજબનો આવતો નથી. સમયસર જરૂરીયાત મુજબ અને પુરતો વરસાદ ન થતા પાક ઉત્પાદનમાં તેની માઠી અસરો જોવા મળે છે. જેથી વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ બાગાયતી પાકોના વાવેતર કરવા જરૂરી વિચારણા અને પુર્વ આયોજન કરવું જરૂરી બને છે. જે તે વિસ્તારમાં સમયસર વરસાદ ન પડે અથવા ઓછા વધતા પ્રમાણમાં હોય તે પરિસ્થિતિમાં ક્યા ક્યા પાક અને કઈ કઈ જાતોનું બિયારણ વાવેતર માટે યોગ્ય રહેશે તેમજ બિયારણ, ખાતર, દવાઓની ઉપલબ્ધી અંગે અગાઉથી ગોઠવણ કરવી પડે છે. કોઈ વિસ્તારમાં સમયસર વરસાદ, મોડો વરસાદ, સારો વરસાદ થયા પછી લાંબા સમય સુધી વરસાદ ન આવે અથવા ચોમાસુ વહેલું પુરૂ થઈ જાય અથવા ચોમાસુ લંબાય તે બધા સંજોગો ધ્યાને રાખી કૃષિ પાકોના વાવેતર અંગેની તૈયારી કરવાની રહે છે. કોઈ પણ કામગીરીની સફળતા માટે આગોતરૂ આયોજન મહત્વનું હોય છે. ગુજરાતમાં વરસાદની અનિયમિતતા અને અચોક્કસતા છે જેથી બાગાયતી પાકોમાં આગોતરૂ પાક આયોજન કરવું જરૂરી બને છે. જે માટે ખેતી ને અસરકર્તા પરિબલો જેવા કે, આબોહવા જમીન, કૃષિ બજારભાવ, પાકપધ્ધતિ, પાણીની ઉપલબ્ધતા, બિયારણ/ખાતરની ઉપલબ્ધતા મજુર અને બજાર વ્યવસ્થા વગેરે મુદ્દાઓ ધ્યાને લઈ આગોતરૂ પાક આયોજન કરવું જોઈએ.

### ૨. જમીન અને આબોહવા :-

રાજ્યની આબોહવામાં પણ ઘણી વિવિધતા જોવા મળે છે. જેમાં ઉષ્ણ ભેજવાળી સુકી અને અર્ધ સુકી આબોહવા વાળા વિસ્તાર છે. સુકી આબોહવામાં ઉત્તર ગુજરાતનો વિસ્તાર તથા સૌરાષ્ટ્રના ઉત્તર અને પશ્ચિમના વિસ્તારનો સમાવેશ થાય છે. ભેજવાળી આબોહવામાં દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે.

#### જમીન :-

રાજ્યની જમીનમાં ભારે કાળી જમીન, રેતાળ જમીન, ગોરાડુ જમીન ક્ષારીય જમીન વગેરેનો સમાવેશ થાય છે. ઉત્તર ગુજરાતની જમીન રેતાળ છે. ગોરાડુ જમીન મધ્ય ગુજરાત અને કાંઠા વિસ્તારમાં જોવા મળે છે. રાજ્યના કાંઠા વિસ્તારમાં ક્ષારીય જમીન પણ જોવા મળે છે. આમ જમીનની વિવિધતાને ધ્યાને લઈ ખરીફ પાક આયોજન કરવું જોઈએ.

### ૩. વરસાદ :-

ચોમાસુ ઋતુમાં વરસાદની શરૂઆત નિયમિત હોય તો જુન માસના મધ્યમાં આવે છે. અને સપ્ટેમ્બર માસના અંતમાં વરસાદ વિદાય લેતા ચોમાસુ પુર્ણ થાય છે. જુનથી સપ્ટેમ્બર

માસ દરમ્યાન કોઈવાર બે વરસાદ વચ્ચેનો ગાળો લંબાય છે.અથવા સતત વરસાદની હેલી જેવું વાતાવરણ રહે છે. ઓગષ્ટ માસ દરમ્યાન વધુ અને સતત વરસાદથી ઉભા પાક તથા ખુલ્લી જમીનમાં લાંબા સમય સુધી પાણી ભરાઈ રહે છે. ઉપરોક્ત જણાવ્યા મુજબની પરિસ્થિતિ રાજ્યના ક્યા વિસ્તારમાં ઉભી થાય તે અંગેની ખુબજ વિવિધતા જોવા મળે છે. અમુક સમયે રાજ્યના અમુક ભાગમાં નહિવત અને ઓછો વરસાદ થતા કૃષિ પાકોનું વાવેતર ન થવાથી અવારનવાર દુષ્કાળની અસર જોવા મળે છે. રાજ્યના મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મોટે ભાગે ચોમાસાની શરૂઆત જુન માસના બીજા સપ્તાહમાં થાય છે. ત્યાર પછી ત્રીજા ચોથા સપ્તાહમાં ચોમાસુ આગળ વધતા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારને આવરી લે છે. સપ્ટેમ્બર માસના અંત સુધીમાં રાજ્યમાં લગભગ ઘણા ખરા વિસ્તારોમાંથી વરસાદની વિદાય થતાં ચોમાસુ પુર્ણ થાય છે. આમ વરસાદની શરૂઆત અને વરસાદની વિદાયને ધ્યાને લઈ કૃષિ પાકોના વાવેતર અંગે અગાઉથી આયોજન કરવું જરૂરી બને છે. આ મુજબ પાક અને પાકની જાતો, ખાતર, મિશ્ર પાક પદ્ધતિની પસંદગી કરવાની રહે છે. રાજ્યમાં ૪૦૦ મી.મી. થી ૨૫૦૦ મી.મી. જેવો ભારે વરસાદ પણ પડે છે. આમ કુલ વરસાદ અને વિસ્તારવાર વરસાદની વહેંચણીમાં પણ અનિયમીતતા જોવા મળે છે.

#### ૪. જમીનનો ઉપયોગ અને પાક પદ્ધતિ:-

રાજ્યના કુલ વિસ્તાર પૈકી ૪૯ ટકા વિસ્તાર જુદા જુદા ખેતી પાકોના વાવેતર હેઠળ સમાવેશ થાય છે. ખેતી હેઠળના કુલ વાવેતર વિસ્તાર પૈકી ૪૬ ટકા વિસ્તારમાં પિયતની જુદી જુદી સુવિધાઓ ઉપલબ્ધ છે. રાજ્યનો મોટાભાગનો વિસ્તાર વરસાદ આધારીત ખેતી હેઠળનો છે. રાજ્યના વિસ્તાર મુજબ જમીન અને આબોહવાની વિવિધતા જોવા મળે છે. જમીન અને આબોહવાની વિવિધતાને કારણે જુદા જુદા વિસ્તારોમાં ખેતીના પાકોમાં પણ વિવિધતા જોવા મળે છે. વિસ્તારવાર જુદા-જુદા બાગાયતી પાકોનું વાવેતર કરવામાં આવે છે. તદુપરાંત મિશ્ર પાક પદ્ધતિ તથા આંતરપાક પદ્ધતિ અપનાવી ખેતી પાકોનું વાવેતર કરવામાં આવે છે.

રાજ્યમાં સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત ૨૦ જુન થી થાય છે. આ સમયે બાગાયતી બહુ વર્ષાયુ ફળ પાકો તેમજ વર્ષાયુ ફળ પાકો જેવા કે કેળ /પપૈયા પાકોની કાપણી તથા ઉનાળુ શાકભાજી પાકોની પાછલી અવસ્થા જોવા મળે છે. સંતોષકારક વરસાદ થાયતો ફળ વાડીમાં ખેડ/ખાતર/ નિંદણ નિયંત્રણ જેવી કામગીરી કરવામાં આવે છે. જ્યારે ઉનાળુ શાકભાજી કરેલ હોય તેવા ખેતરમાં શાકભાજીની છેલ્લી વિણી પુરી થયેથી અથવા પડતર ખેતર તૈયાર કરી નવા ચોમાસુ શાકભાજી પાકોના વાવેતર માટેની શરૂઆત કરવામાં આવતી હોય છે. આ ઉપરાંત બહુવર્ષાયુ બાગાયતી પાકો ની કલમ /રોપાઓનું વાવેતર કરવામાં આવે છે.

રાજ્યના નિયત કરવામાં આવેલ હવામાન આધારીત પાક વિસ્તારોમાં સમાવિષ્ટ જિલ્લાઓમાં નીચે મુજબની કોપીંગ પેટર્ન નો ખેડૂતો દ્વારા અમલ કરવામાં આવે છે.

અ. નુ.	ઉપ વિભાગ	વિભાગ/વિસ્તાર/જિલ્લા	વરસાદ મી.મી.	જમીન	મુખ્ય બાગાયતી પાકો
૧	દક્ષિણ ગુજરાત ભારે વરસાદ પર્વતાલય વિસ્તાર	(૧)ડાંગ,વલસાડ (૨)નવસારી જિલ્લાનો ભાગ(નવસારી અને ગણદેવી તાલુકા સિવાય) (૩)સુરતજિલ્લાનો ભાગ(વાલોડ,વ્યારા,ઉચ્છલ,સોનગઢ અને મહુવા તાલુકો)	૧૫૦૦ મી.મી. અને વધુ	કાળી ચિકણી,આલ્કલી, અને મધ્યમ કાળી	ફળ:-આંબા,ચિકુ,કાજુ,પપૈયા,કોઠા,નાળિયેર શાકભાજી:- રીંગણ,ટામેટા,સુરણ,પરવળ,કાકડી મસાલા:- હળદર,આદુ,મરચા ફુલો:-ગુલાબ,લીલી,ગલગોટા,જાસ્મીન,ગેલાડીયા, ટુબરોઝ, કીસેનથીમમ ઔષધિય અને સુગંધીત:- સફેદમુસલી,એસ્પેરીગસ, કુંવારપાક,ગુગલ,પામારોઝા
૨	દક્ષિણ ગુજરાત	(૧)નવસારી જિલ્લાનો ભાગ(નવસારી અને ગણદેવી તાલુકા) (૨)સુરતજિલ્લાનો ભાગ(કામરેજ,નિઝર,પલસાણા, બારડોલી,માંગરોલ,માંડવી અને ભરુચ અને નર્મદા જિલ્લા)	૧૦૦૦ થી ૧૫૦૦	કાળી ચિકણી,કલે ઇ,	ફળ:-આંબા,ચીકુ,કેળ,પપૈયા,નાળિયેર,જામફળ,લીંબુ શાકભાજી:રીંગણ,ભીંડા,ટામેટા,સુરણ,કંકોડા,કોબીજ, ફલાવર,કાકડી મસાલા:-,આદુ,મરચા ફુલો:-ગુલાબ,લીલી,ગલગોટા,જાસ્મીન ગેલાડીયા, ટુબરોઝ,કીસેનથીમમ ,જર્બેરા,કાર્નેશન ઔષધિય અને સુગંધીત:- સફેદમુસલી,સેના, કુંવારપાક,ગુગલ,
૩	મધ્ય ગુજરાત	વડોદરા,ખેડા,આણંદ, પંચમહાલ અને દાહોદ	૮૦૦થી ૧૦૦૦	ભારે કાળી થી ગોરાડુ,	ફળ:-આંબા,આમળા,પપૈયા,લીંબુ ,સિતાફળ,કેળ શાકભાજી:- રીંગણ,ભીંડા,ટામેટા,કાકડી,સરગવો, કોબીજ,ફલાવર મસાલા:-આદુ,મરચા ફુલો:-ગુલાબ,ગેલાડીયા,ગલગોટા,જાસ્મીન ,લીલી, કીસેનથીમમ,જર્બેરા,કાર્નેશન ઔષધિય અને સુગંધીત: ઇસબગુલ,સફેદમુસલી, સેના,કુંવારપાક,ગુગલ,
૪	ઉત્તર ગુજરાત	(૧)ગાંધીનગર,મહેસાણા,સાબરકાંઠા,(૨)અમદાવાદનો ભાગ(દસ્ક્રોઇ અને સાણંદ) (૩)બનાસકાંઠાનો ભાગ(ડીસા,ધાનેરા,પાલનપુર, દાંતા અને વડગામ તાલુકા)	૬૨૫ થી ૮૭૫	રેતાળ અને ગોરાડુ	ફળ:-આંબા,આમળા,દાડમ,જામફળ,બોરડી, પપૈયા, જામફળ,લીંબુ શાકભાજી:- રીંગણ,ભીંડા,ટામેટા,સરગવો, બટાટા,ગાજર,મુળા,,કોબીજ,ફલાવર,કાકડી મસાલા:આદુ,મરચા,જીરુ,ધાણા,વરીયાળી,મેથી, અજમો ફુલો:-ગુલાબ,ગેલાડીયા,ગલગોટા,જાસ્મીન ઔષધિય અને સુગંધીત:- ઇસબગુલ,સફેદમુસલી, સેના,કુંવારપાક,ગુગલ

૫	ભાલ અને કોસ્ટલ વિસ્તાર	(૧)કચ્છ,પાટણજીલ્લો (૨)રાજકોટ જીલ્લાના મુખ્ય તાલુકા (૩)સુરેન્દ્રજીલ્લાનાહળવદ,ધાંગ ધ્રા,દસાડાતાલુકા(૪)બનાસકાંઠા જીલ્લાનાસાંતલપુર,રાધનપુર, કાંકરેજ,દિયોદર,વાવ,અને થરાદ તાલુકા (૫)અમદાવાદ જીલ્લાના વિરમગામ અને દસકોઇ તાલુકા	૬૨૫ થી ૧૦૦૦	મધ્યમ કાળી, ઓછા નિતાર વાળી અને સલાઇન	ફળ:-આંબા,આમળા,બોરડી, લીંબુ ,સિતાફળ, ફાલસા,ખારેક,દાડમ, શાકભાજી:- રીંગણ,ટામેટા,કાકડી મસાલા:- મરચા,જીરુ,વરીયાળી,અજમો ફુલો:- ગલગોટા ઔષધિય અને સુગંધીત પાકો:- ઇસબગુલ,મેંદી,સેના, કુંવારપાક,ગુગલ,
૬	ઉત્તર સૌરાષ્ટ્ર	(૧)જામનગરજીલ્લો(૨)રાજકોટ જીલ્લાનાપડધરી,લોધીકા,જસદણ,રાજકોટ,વાંકાનેર,મોરબી,જામકંડોરણાઅનેકોટડાસાંગાણી(૩)સુરેન્દ્રજીલ્લાનાવઢવાણ,મુળી, સાયલા,ચોટીલા(૪)ભાવનગર જીલ્લાના ગઢડા,ઉમરાલા અને બોટાદ	૪૦૦ થી ૭૦૦	છીછરી મધ્યમ કાળી	ફળ:-આંબા,આમળા,પપૈયા, લીંબુ,દાડમ,જામફળ,બોરડી,સિતાફળ,જાંબુ શાકભાજી:- રીંગણ,ડુંગળી,ટામેટા,કોબીજ,ફલાવર,કાકડી મસાલા:-મરચા,જીરુ,લસણ,ધાણા,મેથી,અજમો ફુલો:-ગુલાબ,ગલગોટા,ગેલાર્ડીયા,જાસમીન, ઔષધિય અને સુગંધીત પાકો:- ઇસબગુલ,સફેદમુસળી,સેના,કુંવારપાક,
૭	દક્ષિણ સૌરાષ્ટ્ર	(૧) જુનાગઢ (૨) ભાવનગર જીલ્લાનાસિહોર,ઘોઘા,સાવરકુંડલા,ગારીયાધાર,પાલીતાણા,તલાજા,મહુવાતાલુકા(૩)અમરેલી જીલ્લાનાધારી,કોડીનાર,રાજુલા,જાફરાબાદ,ખાંભા,અમરેલી,બાબરા,લીલીયા,લાઠી,કુકાવાવ (૪)રાજકોટ જીલ્લાના જેતપુર,ધોરાજી,ઉપલેટા,ગોંડલ	૬૪૫ થી ૭૦૦	છીછરી મધ્યમ કાળી અને ક્લે જમીન	ફળ:-આંબા,ચીકુ,કેળ,પપૈયા,નાળીયેર,બોરડી, સિતાફળ, શાકભાજી:- રીંગણ,ડુંગળી,ટામેટા,કોબીજ,ફલાવર, લીંડા, કાકડી મસાલા:-મરચા,જીરુ,લસણ,મેથી ફુલો:-ગુલાબ,ગલગોટા,ગેલાર્ડીયા ઔષધિય અને સુગંધીત પાકો:- ઇસબગુલ, સફેદમુસળી,સેના,કુંવારપાક
૮	ઉત્તર પશ્ચિમ એરીડ ઝોન	ખંભાત,ભાલ નો દરિયા કીનારા ના ભરુચ જીલ્લાના હાંસોટ,વાગરા તથા સુરત જીલ્લાનાઓલપાડ(૨)અમદાવાદ જીલ્લાના ધોલકા,ધંધુકા(૪) ભાવનગર જીલ્લાના વલ્લભીપુર,ભાવનગર(૫)સુરેન્દ્રનગર જીલ્લાના લીમડી	૨૫૦ થી ૫૦૦	રેતાળ અને સેલાઇન જમીન	ફળ:-પપૈયા,બોરડી,સિતાફળ, આમળા,જામફળ,દાડમ, શાકભાજી:- રીંગણ,ટામેટા, કાકડી મસાલા:-મરચા,જીરુ,અજમો ફુલો:-ગુલાબ,ગલગોટા,ગેલાર્ડીયા ઔષધિય અને સુગંધીત:- ઇસબગુલ,સેના,કુંવારપાક

૫. પાક ઉત્પાદન માટે આક્રિમિક પાક આયોજન:-

રાજ્યની જે તે વિસ્તારની જુદા જુદા પ્રકારની જમીન અને આબોહવાની પરિસ્થિતિને ધ્યાને લઈ જે તે વિસ્તાર માટે પાકના કોષ ઝોન બનાવવામાં આવેલ છે. વરસાદની શરૂઆત અને વિદાયમાં ખુબ તફાવત અને અનિયમિતતાને કારણે રાજ્યના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પુરની પરિસ્થિતિ ઉભી થાય છે. વરસાદ નહીવત અને ઓછો થવાથી કૃષિ પાકોનું વાવેતર અને ઉત્પાદન ન થતા ઉભા પાકને પુરથી નુકશાન થતાં વિપરીત સંજોગો ઉભા થાય છે. આવી અસર હેઠળના વિસ્તારને વિપરીત સંજોગોનો સામનો કરવા આક્રિમિક પાક આયોજન ખુબજ ઉપયોગી અને અસરકરક બને છે.

૧) સમયસરનો વરસાદ પડે તો

વિસ્તારને અનુરૂપ બાગાયતી પાકોનું વાવેતર સમયસર કરવું તથા નીચે મુજબના અગત્યના મુદા ધ્યાને લેવા

- ❖ બાગાયત ખાતા/રાજ્યની કૃષિ યુનિ.એ ભલામણ કરેલ વધુ ઉત્પાદન આપતી જાતોના પ્રમાણીત બિયારણો/કલમો/રોપાઓનું વાવેતર કરવું.
- ❖ જમીનમાં રહેલા ભેજના પ્રમાણને ધ્યાને લઈ પાયાના અને પુર્તી ખાતર આપવા.
- ❖ ચાલુ વરસાદે પુર્તી ખાતર આપવા નહીં.
- ❖ બીયારણને વાવતા પહેલા ભલામણ મુજબ કુગનાશક દવાનો પટ તથા જૈવિક ખાતરનો પટ આપી વાવેતર કરવું.
- ❖ સમયાંતરે આંતરખેડ કરી નિદામણ દુર કરવું, તેમજ ખેતીમાં જોખમને ટાળવા માટે મિશ્ર પાક પદ્ધતી અપનાવવી.
- ❖ રોગ જીવાતના નિયંત્રણ માટે સંકલીત જીવાત નિયંત્રણ વ્યવસ્થા અપનાવવી.

૨) વરસાદ મોડો પડે, વરસાદ ખેંચાય અથવા ઓછો વરસાદ થાય તો

- ❖ મોટા ભાગના બાગાયતી પાકો પિયત હેઠળ જ લેવામાં આવે છે. જે પાકો ઉભા હશે તેમાં વરસાદ ખેંચાતા પુરક પિયત આપવું. પિયતની સુવિધા હોય ત્યાં શાકભાજી પાકોનું નવું વાવેતર કરવું. નવા ફળપાકોની કલમોનું વાવેતર કરવાનું થાય તો સારા વરસાદની રાહ જોવી અને વાવેતર બાદ જો વરસાદ ખેંચાય તો ૮-૧૦ દિવસના ગાળે પિયત આપવું
- ❖ વરસાદ મોડો થાય તો રીંગણ, ટામેટા, મરચાંનું તૈયાર ધરૂનું વાવેતર કરવું અથવા ટૂંકા ગાળાના શાકભાજી પાકો જેવા કે ગુવાર, ચોળી અથવા પાલક, મેથી, ઘાણા, તાંદલજો જેવા ભાજીવર્ગના પાકોનું વાવેતર કરવું.

- ❖ સ્થાનિક પરીસ્થિતીને અનુરૂપ મસાલા પાક જેવા કે વરીયાળી, સુવા તથા અજમો વગેરેની વાવણી કરી શકાય.
- ❖ જે ખેડૂતોને નવા ફળ પાકોનું વાવેતર કરવું હોય તેઓ જમીનમાં સારો ભેજ હોય ત્યાં સુધીમાં ક્લમો / રોપાનું વાવેતર કરી શકે છે.
- ❖ ચોમાસા દરમ્યાન જરૂરીયાત કરતાં ઓછો વરસાદ હોય, પિયતની પુરતી વ્યવસ્થા ન હોય તો ત્યાં બાગાયતી પાકો કરવા હિતાવહ નથી.પરંતુ સુકા વિસ્તારના બાગાયતી ફળ પાકો કરી શકાય

#### ૬. પાકના પિયતની ક્ટોક્ટીની અવસ્થા:-

પાકને પિયત આપવા માટેનો જથ્થો મર્યાદીત પ્રમાણમાં હોય અને જુદા જુદા પાક હેઠળનો પિયત વિસ્તાર વધારે હોય ત્યાં ઓછા પાણીના વપરાશથી વધુમાં વધુ પાક ઉત્પાદન લેવાય તેવી વ્યવસ્થા ગોઠવવી જરૂરી બને છે. આવા સંજોગોમાં જે તે પાકની ક્ટોક્ટીની અવસ્થાએ અવશ્ય પિયત મળે તે ખાસ ધ્યાને લેવું જોઈએ. ક્ટોક્ટીની અવસ્થાએ પાકને પુરક પિયત આપવાથી પાક ઉત્પાદનમાં ઘટાડો નિવારી શકાય છે. દરેક પાકની ક્ટોક્ટીની અવસ્થા જુદા જુદા સમયે આવે છે. તે સમય દરમ્યાન પાકને ભેજની ખેંચ ન પડે તેની ખાસ કાળજી લેવી જોઈએ. ચોમાસા દરમ્યાન વરસાદના વહી જતાં વધારાના પાણીનો યોગ્ય રીતે સંગ્રહ કરી આ પાણીનો ઉપયોગ પાકની ક્ટોક્ટીની અવસ્થા દરમ્યાન લઈ પાક ઉત્પાદન લઈ શકાય.

- ક્ટોક્ટીની અવસ્થા

પાકનું નામ	પિયત માટેની ક્ટોક્ટીની અવસ્થા	વાવણી/ રોપણી/ તારીખના દિવસો
ફળપાકો	લાંબા ગાળાના ખરીફ પાક હોય ત્યારે ફૂલ આવતા પહેલા વાનસ્પતિક વૃદ્ધિ માટે માફક્સર ભેજ રાખવો.	૧૫-૨૫
રીંગણી, મરચી, ટામેટા	ફૂલ આવવાની શરૂઆત થયા પછી સમયાંતરે સતત પુરા જીવન કાળ દરમ્યાન જરૂરી છે.	૩૫ - ૪૫

## રાજ્યમાં અછતની પરિસ્થિતિમાં બાગાયતદારો માટે પાક બચાવવા માટેની ભલામણો

બાગાયતદારોએ એમનો ઉભો પાક બચાવવા માટે તથા જ્યાં પાક સંપૂર્ણ નિષ્ફળ ગયેલ છે ત્યાં નવા પાકના સમયસર વાવેતરનું આયોજન કરવા નીચે મુજબના પગલાં લેવા ભલામણ કરવામાં આવે છે.

- વિવિધ બાગાયતી પાકોની અવસ્થાને ધ્યાને લઈ નાઈટ્રોજન યુક્ત ખાતર ભલામણ મુજબ પુર્તી ખાતર તરીકે આપવું.
- ફળ વાડીમાં ઝાડ પરથી તૂટી ગયેલ / રોગીષ્ટ ડાળીઓ કાપીને દૂર કરી અને બોર્ડોપેસ્ટ લગાવવી.
- શાકભાજી પાકોના ધરૂ તથા ઉભા પાકમાં મૂળના કોહવારાના નિયંત્રણ માટે ૦.૬ ટકા બોર્ડોમિશ્રણ અથવા ૦.૨ ટકા કોપર ઓકઝીકલોરાઈડ (બ્લાઈટોક્ષ-૫૦% અથવા બલ્યુ કોપર-૫૦% દવા) નો ૪૦ ગ્રામ /૧૦ લીટર પાણીમાં ભેળવી પ્રવાહી મિશ્રણ ધરૂના કચારામાં અથવા છોડની ફરતે જમીનમાં આપવું.
- શાકભાજી ધરૂવાડીયામાં કે ફેર રોપણી બાદ રોગ જણાય કે તુરત જ પાનના ટપકાંના રોગના નિયંત્રણ માટે સ્ટ્રેપ્ટોસાયકલીન ૧ ગ્રામ + ૩૦ ગ્રામ તાંબા યુક્ત દવા (બ્લાઈટોક્ષ-૫૦% અથવા બલ્યુ કોપર-૫૦% દવા) નું ૧૦ લીટર પાણીમાં પ્રવાહી મિશ્રણ બનાવી ૧૫ દિવસના અંતરે ૨ થી ૩ છંટકાવ કરવા.
- વેલાવાળા શાકભાજી પાકોમાં ભુકી છારાના રોગની શરૂઆત થાય કે તુરત જ સલ્ફેક્સ ૮૦% દ્રાવ્ય ગંધક ૩૦ ગ્રામ અથવા ડીનોકેપ ૪૮% પ્રવાહી ૫ મી.લી. અથવા કાર્બેન્ડેઝીમ ૫૦% વેટેબલ પાવડર ૧૦ ગ્રામ પ્રમાણે ૧૦ લીટર પાણીમાં પ્રવાહી મિશ્રણનો ૧૦ થી ૧૨ દિવસના અંતરે ૨ થી ૩ છંટકાવ કરવા.
- શાકભાજી પાકોમાં ચૂસિયા પ્રકારની જીવાતોના નિયંત્રણ માટે શોષક પ્રકારની કીટનાશક દવા જેવી કે ડાયમિથોએટ અથવા મીથાઈલ-ઓ.-ડીમેટોન ૧૦ મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી પ્રવાહી મિશ્રણનો ૧૦ થી ૧૨ દિવસના અંતરે ૨ થી ૩ છંટકાવ કરવા.
- વાવેતર કરેલ બાગાયતી પાકોમાં ધામાં / ખાલા સમયસર પુરવા
- ટૂંકાગાળાના શાકભાજીના પાકો જેવા કે ગુવાર, ચોળી, ભીંડા અથવા પાલક, મેથી, ઘાણા, તાંદળજો, જેવા ભાજીવર્ગના પાકોનું વાવેતર કરવું તેમજ વેલાવાળા શાકભાજી પાકોનું સુધારેલ /હાઈબ્રીડ જાતોનું વાવેતર પણ કરી શકાય.
- રીંગણ, ટામેટા,મરચા જેવા ફેર રોપણીથી વાવી શકાય તેવા પાકોનું ધરૂ મેળવી સમયસર વાવેતર પણ કરી શકાય.

- જે ખેડૂતોને નવા ફળપાકોનું વાવેતર કરવું હોય તેઓ જમીનમાં સારો ભેજ હોય ત્યાં સુધીમાં કલમ / રોપાનું વાવેતર કરી શકે.
- ખેડૂતો મરી મસાલાના પાકોમાં વરિયાળીનું વાવેતર કરવા ઈચ્છતા હોય તો વરીયાળીની રોપણી / વાવણી સપ્ટેમ્બર સુધીમાં થઈ શકશે.
- જે ખેડૂતો એ કોબીજ / ફલાવર જેવા શિયાળું શાકભાજીનું વહેલું વાવેતર કરવાનું આયોજન કરેલ હોય તેઓ આ પાકોનું આગોતરૂ ધરૂવાડીયું કરી શકશે.



## કુદરતી આફતની પરિસ્થિતિમાં પૂર્વ તૈયારી બાબત

બાગાયત ખાતુ, ગુજરાત રાજ્યના કૃષિ અને સહકાર વિભાગના નિયંત્રણ હેઠળ રાજ્યમાં બાગાયતના સંપૂર્ણ વિકાસ માટે કાર્યરત છે.

પ્લાનના ઉદ્દેશ્યો:-

- (૧) કુદરતી આફતની પરિસ્થિતિમાં બાગાયતી પાકોમાં સીધુ નુકશાન, નર્સરીઓ અને ફાર્મના ઉત્પાદનમાં થયેલ નુકશાનીનું તાત્કાલિક સર્વે કરાવવું.
- (૨) રાજ્યમાં બાગાયતી પાકોની ઉત્પાદન અને ઉત્પાદકતા પુનઃ સ્થાપિત કરવી.
- (૩) આફત પછીની સીઝનમાં ઉત્પાદન વધારવું.
- (૪) કચેરી તથા અન્ય માળખાગત સુવિધાને થયેલ નુકશાનની મરામત.

કાર્યરત માળખાગત સુવિધા:-

બાગાયત વિભાગની જુદા જુદા સ્તરે સ્ટાફની પેટર્ન નીચે મુજબ છે.

બાગાયત નિયામક.....રાજ્ય કક્ષાએ



સંયુક્ત બાગાયત નિયામક.....રાજ્ય કક્ષાએ



સંયુક્ત બાગાયત નિયામક..... વિભાગીય કક્ષાએ (૨ વિભાગ)



નાયબ/ મદદનીશ બાગાયત નિયામક..... જિલ્લા કક્ષાએ



બાગાયત અધિકારી.....તાલુકા કક્ષાએ

ઉપરની માળખાગત સ્ટાફ સુવિધા ઉપરાંત નીચે દર્શાવેલ અધિકારીશ્રીઓ માહિતી અને પુનઃ સ્થાપન પ્રવૃત્તિઓની સંપૂર્ણ દેખરેખની જવાબદારી ખાતા કક્ષાની ઉપર તથા નીચેના સ્તરે સંકલનમાં રહી નિભાવે છે.

તાત્કાલિક સંપર્ક ગ્રુપ:-

- (૧) સંયુક્ત બાગાયત નિયામકશ્રી (આયોજન-સંકલન) બાગાયત નિયામકશ્રીની કચેરીના મુખ્ય નોડલ અધિકારી તરીકે કામગીરી કરશે તેમજ કૃષિઅને સહકાર વિભાગના તથા ક્ષેત્રીય કક્ષાની કચેરીઓ વચ્ચે સંકલનમાં રહેશે.
- (૨) સંયુક્ત બાગાયત નિયામકશ્રી (વિભાગીય કક્ષા)ની કચેરીના નાયબ બાગાયત નિયામકશ્રી તેમના વિભાગના જિલ્લા અધિકારીશ્રીઓના સંકલનમાં રહેશે.
- (૩) જિલ્લાના નાયબ/ મદદનીશ બાગાયત નિયામકશ્રી તેઓના તાલુકા કક્ષાના અધિકારીશ્રીઓના સંકલન અધિકારી તરીકે ફરજ બજાવશે. ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવકની મદદથી કાર્યવાહી કરવામાં આવશે.

પ્લાન હેઠળ કરવામાં આવનાર પ્રવૃત્તિઓ:-

- (૧) અસરગ્રસ્ત વિસ્તાર નક્કી કરવો.
- (૨) નુકશાનનો પ્રકાર તથા અંદાજ મેળવવો.
- (૩) તાત્કાલિક લાગતા વળગતા સત્તાધિશોને રીપોર્ટિંગ કરવું.
- (૪) બાગાયતી પાકો અને ખેત પ્રવૃત્તિઓ અંગેનો કન્ટીજન્સી પ્લાન તૈયાર કરવો.
- (૫) થયેલ નુકશાનનો સર્વે અને અંદાજ મેળવવો.
- (૬) રાહત અને બચાવ કામગીરી માટેની તૈયારી અને પ્રોગ્રામ તૈયાર કરવો.
- (૭) કરવામાં આવેલ પ્રોગ્રામનું સંપૂર્ણ મુલ્યાંકન.